

B.Com. Semester - 1 (CBCS) Examination**Nov./Dec. -2018 (New Course)****ACCOUNTING - 1(ELECTIVE-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 મિ.વિશાલ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. તેમનું 31/3/2017નાં રોજનું કાયું સરવૈયું નીચે મુજબ છે.

(20)

ઉધાર બાકી	રકમ રૂ.	જમા બાકી	રકમ રૂ.
અસીલોનાં ખાતા	80,000	મૂડી	5,00,000
પગાર	60,000	મળેલ ફી	4,00,000
પુસ્તકો	50,000	અસીલોનાં ખાતાં	25,000
દેવાદારો	20,000	બેન્ક લોન	50,000
સ્ટેશનરી	10,000	અસીલ પરચૂરણ	10,000
રોકડ બેંક	50,000		
ઓફિસ વીજળી ખર્ચ	10,000		
LIC પ્રીમિયમ	20,000		
ઓફિસ મકાન	4,00,000		
મોટરકાર	1,35,000		
ઓફિસ ખર્ચા	40,000		
મેગેઝિન ખર્ચ	7,000		
પોસ્ટેજ	3,000		
ફર્નિચર	50,000		
કમ્પ્યુટર ખરીદી	50,000		
(1/10-2016)			
	9,85,000		9,85,000

વધારાની માહિતી:-

- (1) અસીલ વતી કરેલ ખર્ચ રૂ.3,000 ઓફિસ ખર્ચમાં ગણેલ છે.
- (2) એક અસીલ પાસેથી રૂ.7,000 પરચુરણ ખર્ચ પેટે મળેલ તેનો સમાવેશ અસીલ એડવાન્સ ખાતામાં થયો છે.
- (3) કમ્પ્યુટર પર 10% મકાન પર 5% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો.
- (4) મળવા બાકી ફી રૂ.50,000 છે.

રોકડનાં ધોરણે વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

તેઓની 31-3-2018નાં રોજની બાકીઓ નીચે મુજબ છે.

ઉધાર બાકી	રકમ રૂ.	જમા બાકી	રકમ રૂ.
અસીલોનાં ખાતાં	35,000	કુલ મૂડી:	
પગાર	20,000	P 1,60,000	
પુસ્તકો	17,500	Q 80,000	
દેવાદારો	56,500	R 40,000	2,80,000
સ્ટેશનરી	3750	કુલ ફી	2,05,000
બેંક	22,500	અસીલોનાં ખાતાં	5,000
તાર-ટપાલ	4,500	લેણદારો	35,000
ઓફિસ મકાન	2,50,000	અસીલ પરચુરણ ખર્ચ ખાતાવહી	3,750
મોટરકાર	50,000		
ઓફિસ ખર્ચ	9,000		
ફર્નિચર	60,000		
	5,28,750		5,28,750

વધારાની માહિતી:-

- (1) અસીલો વતી ચુકવેલ રૂ.500નો સમાવેશ ઓફિસ ખર્ચમાં થયેલ છે.
- (2) એક અસીલ વતી પરચુરણ ખર્ચ પેટે રૂ.2500 મળેલ તેનો સમાવેશ અસીલ એડવાન્સ ખાતામાં થયેલ છે.
- (3) મકાન, મોટરકાર, ફર્નિચર અને પુસ્તકો પર 10% ઘસારો ગણો.
- (4) મળવા બાકી ફી રૂ.15,000 છે.
- (5) મૂડી પર 10% લેખે વ્યાજ ગણો.
- (6) વર્ષને અંતે અધુરા કામ રૂ.7,500 છે.

તા.31/3/2018નાં રોજ પુરા થતા વર્ષનાં રોકડનાં ધોરણે વાર્ષિક હિસાબો ગણો.

પ્રશ્ન-2 સચીને તા.1/1/2015નાં રોજ લક્ષ્મી ઓટો પાસેથી એક સ્કુટર ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદ્યું. કરાર કરતી (20)

વખતે રૂ.8,900 ચુકવ્યા અને બાકીની રકમ નીચે મુજબ ત્રણ વાર્ષિક હપ્તામાં ચુકવી.

- (1) તા.31/12/2015 Rs. 11,400
- (2) તા.31/12/2016 Rs. 10,500
- (3) તા.31/12/2017 Rs. 9,600

સચીન દર વર્ષ સ્કુટર પર 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણો છે.

સચીનનાં ચોપડે:- (તૈયાર કરો)

- (1) પ્રથમ વર્ષની આમનોંધ.
- (2) સ્કુટર ખાતું તેમજ લક્ષ્મી ઓટોનું ખાતું.

જરૂરી ગણતરીઓ દર્શાવો.

અથવા

(20)

રામનાં ચોપડે દરેક વર્ષની આમનોંધ અને જરૂરી બધાજ ખાતાઓ તૈયાર કરો.

પ્રશ્ન-૩ એક જહાજ “જલ સુંદરી” તા.૧/૧૧/૨૦૧૭નાં રોજ કંડલાથી મુંબઈની સફર શરૂ કરી તા.૨૬/૩/૨૦૧૮નાં રોજ (૧૫) કંડલા પરત ફર્યું.

સફરની માહિતી નીચે મુજબ છે.

(1) પગાર (વાર્ષિક)	30,000
(2) કોલસો	30,000
(3) કપ્તાન પગાર (ત્રિ-માસિક)	9,000
(4) વહિવટી ખર્ચા (અર્ધ વાર્ષિક)	20,000
(5) વહાણનો વીમો (માસિક)	2,000
(6) વપરાયેલ સ્ટોર્સ	9,000
(7) પરચુરણ ખર્ચા	20,000
(8) નૂર:- જતા.....	1,00,000
વળતા.....	70,000
(9) એડ્રેસ કમિશન.	1%
(10) પ્રાઇમેઝ - નૂરના	2%
(11) નૂરનો વીમો	3%
(12) મેનેજરને કમિશન - નૂરના	6%
(13) વહાણનો ધસારો	5%

જહાજની કિંમત Rs.8,00,000 છે.

“જલ સુંદરી” જહાજનું સફરખાતું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-૩ નીચેની માહિતી પરથી “જલપરી” જહાજનું સફરખાતું તૈયાર કરો.

- (1) સફરનો સમય 1/1/2017થી 14/3/2017 (બંને દિવસો સહિત)
(2) આવક:-જતા 1500 ટન અનાજ ટન દીઠ રૂ.60.

વળતા 2000 ટન કોલસો ટન દીઠ રૂ.60.

અન્ય આવકો : મુસાફર ભાડુ રૂ. 1,500

ટપાલ ભાડુ રૂ. 6,000

(3) ખર્ચાઓ:-

બાળતાણ ખર્ચા:-

શરૂ સ્ટોક	Rs.	11,000
ખરીદી	Rs.	37,000
આખર સ્ટોક	Rs.	12,080
અન્ય જહાજને આપેલ	Rs.	5,100
પગાર (અર્ધ વાર્ષિક)	Rs.	35,000
બંદર ખર્ચા	Rs.	6,000
મરામત ખર્ચા	Rs.	5,500

નૂરનો વીમો નૂરના 2%

અન્ય વિગતો:-

- પ્રાઇમેઝ નૂરનાં 10%
- મરામત અનામત Rs.6,000
- એડ્રેસ કમિશન:- જતા નૂર પર 4%

વળતા નૂર પર 5%

- જહાજની મૂ.કિ. રૂ.20,00,000 છે. જહાજ પર સીધી લીટી પદ્ધતિથી 10% ઘસારો ગણો.
- જહાજનું વી.પી. વાર્ષિક 2%
- મેનેજરને કમિશન બાદ કર્યા પછીનાં નફા પર 10% કમિશન આપવાનું છે.

પ્રશ્ન-4 એક કારખાનાની માર્ચ-2018ની માલસામગ્રી M અંગેની આવક-જાવકની માહિતી નીચે મુજબ છે.

(15)

આવક			જાવક	
તારીખ	એકમો	એકમદીઠ કિંમત	તારીખ	એકમો
માર્ચ- 1	90	4	માર્ચ - 12	150
માર્ચ- 5	180	6	માર્ચ- 20	240
માર્ચ- 14	210	6	માર્ચ- 29	30
માર્ચ- 25	90	8		

તા.12/03/2018 અને તા.20/03/2018નાં રોજની જાવકની કિંમત નક્કી કરવા માટે અનુક્રમે લીફો (LIFO) અને ફીફો (FIFO) પદ્ધતિ ધ્યાનમાં લેવી તથા તા.25/03/2018નાં રોજથી જાવકનાં મૂલ્યાંકન માટે ભારીત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો.

માલસામાન M નું સ્ટોક પત્રક તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-4 એક કંપનીનાં માલસામાન “A” ની માર્ચ-2018ની વિગતો નીચે મુજબ છે.

(15)

ખરીદી: 1/3/2018 : સ્ટોક 100 એકમો, એકમદીઠ રૂ.5 લેખે.

5/3/2018 : 300 એકમો, એકમદીઠ રૂ.6 લેખે.

8/3/2018 : 500 એકમો, એકમદીઠ રૂ.7 લેખે.

12/3/2018 : 600 એકમો, એકમદીઠ રૂ.8 લેખે.

ઉત્પાદન વિભાગને પુરો પાડેલ માલ:-

6/3/2018 → 250 એકમો.

10/3/2018 → 400 એકમો.

14/3/2018 → 500 એકમો.

ફીફો (FIFO) પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો.

ENGLISH VERSION

Que-1 Following is trail balance of Mr.Vishal a C.A. as on 31/3/2017.

(20)

Balance	Dr. (Rs.)	Balance	Cr. (Rs.)
Clients Accounts	80,000	Capital	5,00,000
Salaries	60,000	Fee received	4,00,000
Books	50,000	Clients Accounts	25,000
Debtors	20,000	Bank Loan	50,000
Stationary	10,000	Clients ledger account for Misc. expenses	10,000
Cash and Bank	50,000		
Office Light	10,000		
LIC Premium	20,000		
Office building	4,00,000		
Motor Car	1,35,000		
Office expenses	40,000		
Subscription of Journals	7,000		
Postages	3,000		
Furniture	50,000		
Computer Purchased (1/10/16)	50,000		
	9,85,000		9,85,000

Additional Information:-

- (1) An expenditure of client for Rs.3,000 is included in office expenses.
- (2) Client's advances includes Rs.7,000 received for their miscellaneous expenses from clients.
- (3) Provide depreciation on computer 10%, on office building 5%, on Furniture 5%.
- (4) Fees not collected a Rs.50, 000.

Prepare final Account on cash basis.

OR

- Que-1 P, Q and R are partners sharing P/L in ratio of 2:2:1 in a solicitor firm. (20)
Their balances as at 31/3/2018 were at below.

Debit	Rs.	Credit	Rs.
Accounts of Clients	35,000	Total Capital:	
Salaries	20,000	P 1,60,000	
Books	17,500	Q 80,000	
Debtors	56,500	R <u>40,000</u>	2,80,000
Stationery	3750	Total Fees.	2,05,000
Bank	22,500	Accounts of Clients	5,000
Postages	4,500	Creditors	35,000
Office building	2,50,000	Sundry exp. Ledger of Clients	3,750
Motor Car	50,000		
Office expenses	9,000		
Furniture	60,000		
	5,28,750		5,28,750

Additional information:-

- (1) Rs.500 paid for clients are included in office expenses.
- (2) Rs.2,500 received for clients for sundry exp. are credited in advance account of client.
- (3) Provide 10% depreciation on Building, Motorcar, Furniture and Books.
- (4) Fees to be received Rs.15,000.
- (5) Allow to 10% interest on Capital.
- (6) Unfinished work Rs.7,500 at the end of the year prepare final account on cash basis the year ending on Dt.31/3/2018.

- Que-2 Sachin purchased a scooter from Laxmi auto under hire purchase system as on 1/1/2015. (20)
He paid Rs.8,900 on signing the contract and the rest of the amount in three annual installment as under.

- (1) Dt.31/12/2015 Rs. 11,400
- (2) Dt.31/12/2016 Rs. 10,500
- (3) Dt.31/12/2017 Rs. 9,600

Sachin charged 10% p.a. depreciation on scooter by diminishing balance method.

Pass Journal entries for the first year only in the books of Sachin and prepare scooter A/c. and Laxmi auto A/c. & show necessary calculation also.

OR

- Que-2 Shri Ram purchased a Machine on a hire purchase system from Shyam on 1/1/2010. (20)
The conditions were as below.

- (1) Cash price Rs. 80,000
- (2) Paid on 1/1/2010 Rs. 30,000
- (3) Paid on 31/12/2010 Rs. 25,000
- (4) Paid on 31/12/2011 Rs. 18,000
- (5) Paid on 31/12/2012 Rs. 16,500
- (6) The rate of interest per annum 10%.
- (7) Charged 10% depreciation p.a. on cash price (on straight line method)

Write Journal entries and All necessary A/c. in the books of Shri Ram.

Que-3 A ship “JALSUNDRI” voyage on 1/11/2017 from Kandla to Bombay and returned to kandla (15)
on 26/3/2018.

Detail are as under.

Details	Rs.
(1) Salaries	30,000
(2) Coal	30,000
(3) Captain’s salaries (for three months)	9,000
(4) Administrative expenses (Half yearly)	20,000
(5) Ship insurance (Monthly)	2,000
(6) Stores used	9,000
(7) Sundry expenses	20,000
(8) Freight for out word journey.	1,00,000
Freight for return journey.	70,000
(9) Address commission	1%
(10) Primage (on freight)	2%
(11) Freight insurance	3%
(12) Manger’s commission on freight	6%
(13) Depreciation of ship	5%

Value of ship Rs.8,00,000.

Prepare voyage A/c of the “JALSUNDRI” ship.

OR

Que-3 From the following information prepare “Voyage A/c.” of “JALPARI” ship.

(1) Time of voyage 1/1/2017 to 14/3/2017 (Included both days)

(2) Freight:-

Inward:- 1500 tone grain per Rs.60

Return:- 2000 tone coal per Rs.60

Other income:- Pasenger rent Rs.15,000

Postage ” Rs.6,000.

(3) Expenses:-

Fuel charges:-

Opening stock	Rs.	11,000
Purchases	Rs.	37,000
Closing stock	Rs.	12,080
Supplied to other ship	Rs.	5,100
Salaries (six month)	Rs.	35,000
Port charges	Rs.	6,000
Maintenes exp.	Rs.	5,500
Freight insurance 2%.		

Other information:-

- Primage 10% on Freight.
- Maintance Reserve Rs.6000
- Address Commission
On, inward freight 4%
On, outward freight 5%
- The Books value of ship is Rs.20,00,000 Depreciate 10% on ship by straight line method.
- Insurance premium of ship annual 2%.
- The manager has right to get the commission at 10% on net profit after deducting his commission.

Que-4 The following is a summary of a receipts and issues of a company of material “M”. (15)

Receipt			Issue	
Date	Units	Price per unit	Date	Units
March- 1	90	4	March- 12	150
March- 5	180	6	March- 20	240
March-14	210	6	March- 29	30
March-25	90	8		

The material issued on 12/3/2018 and 20/3/2018 were priced on LIFO and FIFO basis respectively. It was decided to price the issues by weighted Average method from the date 25/3/2018.

Prepare stock register for Material – M.

OR

Que-4 One Company provides detail regarding material ‘A’ for the march-2018. (15)

Purchases: 1/3/2018 : Stock 100 units, Rs.5 per unit.

5/3/2018 : 300 units, per unit Rs.6

8/3/2018 : 500 units, per unit Rs.7

12/3/2018 : 600 units, per unit Rs.8

Material issued to production department:-

6/3/2018 → 250 Units.

10/3/2018 → 400 Units.

14/3/2018 → 500 Units.

Prepare stock register as per “FIFO” method.
